

30 ઓક્ટોબર 2018

## સુરક્ષિત રીતે દિવાળી ઉજવશો: ટૂંકી રેન્જના ફટાકડાને મંજૂરી 6 અને 7 નવેમ્બર

બ્રેમ્પટન, ઓન્ટારિયો – દિવાળી ચાર મંજૂર થયેલ રજાઓ પૈકી એક છે જ્યારે પરમીટની જરૂરિયાત વિના ખાનગી મિલકતોમાં ટૂંકી રેન્જના ફટાકડા ફોડવાની છૂટ છે. આ વર્ષે દિવાળી નવેમ્બર 6ને મંગળવાર અને નવેમ્બર 7ને બુધવારે ઉજવાશે\*. સીટી ઓફ બ્રેમ્પટનની ઈચ્છા છે કે નિવાસીઓ સુરક્ષિત રીતે ઉજવાણી કરે.

ટૂંકી રેન્જના એટલે એવા ફટાકડા જે ચેતાવ્યા બાદ ત્રણ મીટર (10 ફુટ) કરતા ઓછું અંતર કાપે છે (દા.ત. કોઠી, ચકરીઓ, ભોય ચકરીઓ, તારામંડળો). અન્ય તમામ રોકેટ પ્રકારના ફટાકડા ફોડવા પર બ્રેમ્પટનમાં નિષેધ છે. સીટી રહેવાસીઓને યાદ અપાવે છે કે માર્ગો પર, ફુટપાથ પર, સીટી પાર્ક્સની અંદર અથવા નગરપાલિકા કે શાળાની મિલકતો પર ફટાકડા ફોડવાની છૂટ નથી.

**તમારી મિલકત પર ટૂંકી રેન્જના ફટાકડાનો ઉપયોગ કરતી વખતે તમારે નીચે આપેલ સુરક્ષાની સાવચેતીઓ અનુસરવાની રહેશે:**

- તમારે પાણીનું પાત્ર અથવા પાણી ભરેલી હોઝ લાઈન લાથવગી રાખવી જે ફટાકડા ઓલવી શકે
- તમારે ક્યારેય લાથમાં ફટાકડા ચેતવવા નહીં અથવા સળગતા ફટાકડા લાથમાં પકડવા નહીં સિવાયકે તારામંડળ
- તારામંડળનો ઉપયોગ કર્યા પછી હંમેશા તેને પાણીની ડોલમાં ડૂબાડી દેવા જેથી નિકાલ કરતા પહેલા તે ઠંડા પડી જાય
- નિકાલ કરતા પહેલા બધાં ફટાકડા સંપૂર્ણ રીતે ઠંડા પાડી દેવા

ફટાકડાના વિક્રેતાઓને વેચાણ માટે પરવાના આપવામાં આવે ત્યાર પહેલા ગત વર્ષે બ્રેમ્પટન દ્વારા ફરજિયાત વાર્ષિક અભ્યાસક્રમ દાખલ કરવામાં આવ્યો. દિવાળી પર બ્રેમ્પટન ખાતે ફટાકડા વેચવા માટે લાયસન્સ ધરાવતા વિક્રેતાઓની યાદી દિવાળીની આસપાસના દિવસોમાં સીટીની વેબસાઈટ પર પોસ્ટ કરવામાં આવશે.

તમે કોઈ પણ પ્રતિબંધિત ફટાકડાનો ઉપયોગ થતો જોતા તમને ચિંતા થાય તો 311 ને કોલ કરશો.

ફટાકડા અને લાયસન્સિંગ અંગેના નવા ઉપનિયમોને કાઉન્સિલ દ્વારા 2016માં મંજૂરી આપવામાં આવી હતી. વિક્ટોરિયા ડે, કેનેડા ડે, દિવાળી અને નવા વર્ષની પૂર્વ સંધ્યા પર પરમીટની જરૂરિયાત વિના તમામ બ્રેમ્પટનની રહેઠાણ ધરાવતી મિલકતો પર ટૂંકી રેન્જના ફટાકડાના ઉપયોગ ને ઉપનિયમો મંજૂર કરે છે. સુરક્ષા ટોચની અગ્રિમતા ધરાવે છે, કારણકે ઉપનિયમ એવા અન્ય પ્રકારના ફટાકડા પર પણ પ્રતિબંધ ફરમાવે છે જે મિલકતને નુકસાન અથવા ઈજા પહોંચાડવાનું ઉચ્ચ જોખમ ધરાવતા હોય.

શીઘ્ર લિંક્સ

- [इटाकडा सुरक्षा विडियो](#)
- [इटाकडा विषे वारंवार पुछाता प्रश्नो](#)

\*Source: पीव डिस्ट्रिक्ट स्कूल बोर्ड [रज्याओ अने रजानुं कॅलेन्डर 2018-2019](#)

-30-

मिडिया संपर्क :

क्रिस्टिन शर्मा (Christine Sharma)

मिडिया रिलेशन्स

सीटी ओफ् ब्राम्पटन

905.874.2880 | [christine.sharma@brampton.ca](mailto:christine.sharma@brampton.ca)